

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,
અમદાવાદ શહેર

“પ્રોએક્ટીવ ડીસ્કલોજર”

માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫

વર્ષ:- ૨૦૧૮-૨૦

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,
ગોતા ઓગણજ રોડ, ગોતા, જિ. અમદાવાદ
ફોન.નં: ૦૭૯-૨૬૭૬૬૭૫૫
ઈ-મેઇલ: diet-urban-ahd@gujarat.gov.in
વેબસાઇટ: www.dietahmdcity.org

૧૨.Right to Information Act:

પ્રસ્તાવના

માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫નો અમલ તા. ૧૨/૧૦/૦૫થી શરૂ થયેલ છે આ અધિનિયમ કલમ-૪ દરેક જાહેર સત્તા મંડળે કલમ ૫(બ)માં દર્શાવેલ જુદીજુદી ૧૭ પેટા કલમ મુજબની માહિતી જાહેર પ્રજાની જાણ ખાતર પ્રસિદ્ધ કરવાની થાય છે. જે જોગાવઈ મુજબ સરકારશ્રીના વિવિધ વિભાગો, વિવિધ ખાતાના વડાઓ અને પ્રદેશ તેમજ જિલ્લા તથા તાલુકા કક્ષાએ આવેલી કચેરીઓ ઉપર દર્શાવ્યા મુજબની માહિતી પ્રસિદ્ધ કરવાની થાય છે.


જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની કચેરીની રચના પ્રાથમિક સ્તરે શિક્ષણના ઉધ્વીકરણ કરવાના ભાગરૂપે કરવામાં આવી છે. આ કચેરી સંલગ્ન માહિતી અંગે સંલગ્ન સંસ્થાઓની માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબ જેને માહિતી મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય તેઓના ઉપયોગ અર્થે અધિનિયમની કલમ-૪ (ખ) ની પેટા કલમ (૧) થી (૧૭) મુજબની માહિતી આથી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

મુદ્રા નં. ૧

પ્રાચ્યાર્થશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમદાવાદ શહેરનું વ્યવસ્થા તંત્ર, કાર્યો અને ફરજોની વિગત

કચેરીનું નામ:	જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અમદાવાદ શહેર
સરનામું:	ગોતા ઓગણજ રોડ, ગોતા, જિ. અમદાવાદ કોન.નં: ૦૭૯-૨૮૭૮૬૭૫૫
કચેરીના વડા:	પ્રાચ્યાર્થ
નિયંત્રણ અધિકારી:	નિયામકશ્રી, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીન પરિષદ, વિદ્યાભવન, સેક્ટર-૧૨, ગાંધીનગર
વિભાગનું નામ:	શિક્ષણ વિભાગ
કાર્યક્ષેત્ર:	અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન તથા દેશોજ, માંડલ, વિરમગામ તાલુકા
ધ્યેય:	પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલ તમામના સાથ સહકારથી પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં હાથ ધરાતી વિવિધ વ્યૂહરચના અને કાર્યક્રમોની સફળતા માટે પાયાના સ્તરે શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડવું.
વિઝન:	જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં અને પ્રશિક્ષણ સંસ્થાઓમાં શિક્ષકો અને પ્રશિક્ષકોને શૈક્ષણિક તાલીમ તેમજ સંશોધન, નિરીક્ષણ, મૂલ્યાંકન માટે માર્ગદર્શન પૂરું પાડવું.
હેતુઓ:	<ul style="list-style-type: none"> ❖ પૂર્વ સેવા કાલીન અને સેવા કાલીન તાલીમ કાર્યક્રમો કરવા. ❖ જિલ્લા અને રાજ્ય કક્ષાના શૈક્ષણિક સંશોધનો કરવા. ❖ શૈક્ષણિક સાહિત્યનું નિર્માણ કરવું. ❖ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવતાં નવતર પ્રયોગોનું સંકલન કરવું અને શેરીગ કરવું. ❖ જિલ્લાની શૈક્ષણિક જરૂરીયાતોને આધારે વિવિધ પ્રકારના તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવું. ❖ શૈક્ષણિક મૂલ્યાંકન સંદર્ભે શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડવું.

કચેરી માળખું



જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના કાર્યો ટૂંકમાં નીચે મુજબ છે.

૧. નીચેના લક્ષ્યાંકિત જૂથોના તાલીમ અને સંસ્કરણ:

- પ્રારંભિક શાળાના શિક્ષકો (પૂર્વસેવા અને સેવા અંતર્ગત) એમ બંને પ્રકારના શિક્ષકોને તાલીમ આપવી તથા સંસ્કરણ કાર્ય કરવું.
- મુખ્ય શિક્ષક, શાળા સંકુલના વડાઓ અને શિક્ષણ વિભાગના ઘટક કક્ષા સુધીના અધિકારીઓને તાલીમ આપવી.
- અશાલેય અને પ્રૌઢ શિક્ષણના પ્રશિક્ષકોને તાલીમ આપવી.
- જિલ્લા શિક્ષણ બોર્ડ અને ગ્રામ શિક્ષણ સમિતિઓના સભ્યો, શૈક્ષણિક પ્રવૃત્તિ તરીકે કામ કરવા ઈચ્છતા સમૃદ્ધાયના નેતાઓ, યુવાનો તથા અન્ય સ્વયંસેવકોને તાલીમ આપવી.
- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સિવાયના અન્ય કેન્દ્રો ખાતે જણાવેલ લક્ષ્યાંકિત જૂથો માટે તાલીમ આપી શકે તેવી યોગ્ય વ્યક્તિઓ, તજ્જોને તાલીમ આપવી.

૨. જિલ્લામાં પ્રારંભિક અને પ્રૌઢ શિક્ષણમાં....

- અન્ય સંસ્થાઓ સાથે આદાન પ્રદાન કરી શકે તથા સેવાની વિસ્તૃત પ્રવૃત્તિઓની જોગવાઈ હાથ ધરવી.
- શિક્ષકો અને પ્રશિક્ષકો માટે સાધનો અને શીખવવાના કેન્દ્રોની સેવાઓની જોગવાઈ કરવી.
- સ્થાનિક રીતે મળી શકે તે મુજબની સામગ્રી શૈક્ષણિક સાધનો, મૂલ્યાંકન સાધનો વગેરેનો વિકાસ કરવો.
- પ્રારંભિક શાળાઓ અને અશાલેય-પ્રૌઢ શિક્ષણના કાર્યક્રમો માટે મૂલ્યાંકન કેન્દ્રો તરીકે સેવાઓ આપવી તથા શૈક્ષણિક અને સાધનિક સહાય પૂરી પાડવી.

૩. અન્ય કામગીરી

- તમામ કાર્યોનું સંકલન કરવું.
- તજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદને સામગ્રી વિકાસ પરીક્ષણ અને મોનીટરીંગમાં મદદ કરવી.

પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ ફરજ બજાવે છે. શૈક્ષણિક કર્મચારીઓની કામગીરીનું શાખાઓ પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.

1. પૂર્વ સેવા શિક્ષક શિક્ષણ શાખા (PSTE)
(Pre-service Teacher Education)
2. કાર્યાનુભવ શાખા (WE)
(Work Experience)
3. જિલ્લા સંસાધન એકમ (DRU)
(District Resource Unit)
4. સેવા અંતર્ગત કાર્યક્રમો, ક્ષેત્રીય આંતરરક્ષિયા અને નાવીન્ય સંકલન શાખા (IFIC)
(In-service Programmes, Field Interaction , Innovation and Co-ordination)
5. પાઠક્રમ સામગ્રી વિકાસ અને મૂલ્યાંન શાખા (CMDE)
(Curriculum, Material Development and Evaluation)
6. શૈક્ષણિક પ્રાયોગિકી શાખા (ET)
(Educational Technology)
7. સંયોજન અને વ્યવસ્થાપન શાખા (P & M)
(Planning & Management)

ઉપર જણાવેલ શાખાઓ અંતર્ગત શાખાના વ્યાખ્યાતાઓ ફરજ બજાવતા હોય છે. તેની વિસ્તૃત માહિતી શાખાવાર આ સાથે જણાવી છે.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન શૈક્ષણિક શાખાઓ-કર્તવ્યો અને માળખાં

શાખા	કર્તવ્યો	કર્મચારીને નિયુક્ત કરવાની પદ્ધતિ
૧	૨	૩
<p>૧. પૂર્વ સેવા શિક્ષક શિક્ષણ શાખા (PSTE) (Pre-service Teacher Education)</p> <p>૧.નીચેની બાબતોમાટે કેન્દ્રવર્તી શાખા તરીકે સેવા આપવી.</p> <p>(૧) પ્રારંભિક શાળાના શિક્ષકો માટે પૂર્વસેવા તાલીમ અભ્યાસએમાંનું સંચાલન. (પ્રવેશ, પ્રશિક્ષણ અને મૂલ્યાંકન સહિત) અને આ શાખા દ્વારા અધ્યાપન કરવાતા વિષયોના (ખાના-૩ માં દર્શાવેલ) આવા અભ્યાસએમાં શૈક્ષણિક માહિતી પૂરી પાડવી.</p> <p>(૨). તાલીમ, વિસ્તરણ, યોગ અધ્યાપન સામગ્રી તૈયાર કરવી, કામગીરીશરંશોધન વગેરે દ્વારા (૩) વિદ્યાર્થીલક્ષી શિક્ષણ અને (૪) વ્યક્તિત્વ વિકાસ માટેના શિક્ષણ (મૂલ્યોને સંસ્કૃતિક શિક્ષણ સહિત)નો પ્રચાર કરવો.</p> <p>(૩) અધ્યાપન પદ્ધતિ વિજ્ઞાનને લગતી તમામ બાબતો (દા.ત. વિવિધ કક્ષાનું અધ્યાપન અને સમાન જૂથ શિક્ષણ વગેરે) અને શાખા અધ્યાપન કરવતા અશાલેય શિક્ષણના વિષયો માટેના શાળાના અધ્યાપન પદ્ધતિ વિજ્ઞાનને લગતી નિર્દિષ્ટ બાબતો.</p> <p>(૪) જિલ્લાની શાળાઓ અને અશાલેય શિક્ષણ પ્રૌઢ શિક્ષણને માટે મનોવૈજ્ઞાનિક સલાહ અને માર્ગદર્શન સેવાઓની જોગાવાઈ કરવી.</p> <p>(૫) અભાવગ્રસ્ત જૂથોના બાળકોની શીખવાની પ્રક્રિયાને લગતીબધી જ બાબતો. (દા.ત. શીખાઉ વિદ્યાર્થીઓની પ્રથમ પેઢી માટે ખાસ ઉપયોગિતાની પ્રશિક્ષણ.)</p> <p>(૬) મોટીપંગુતા તથા અન્યની (શારીરિક કે માનસિક) પંગુતાવાળા બાળકોનું શિક્ષણ.</p> <p>(૭) પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શિક્ષણ.</p> <p>૨. જેના મુદ્દાઓ અન્ય રીતે કે પ્રધાનપણે શાળા દ્વારા શીખવાતા વિષયોને અથવા તેના ઉક્ત (૧) ના ફક્રા (૨) થી (૭) હેઠળ દર્શાવેલ કેન્દ્રવર્તી જવાબદારીઓના અન્યક્ષેત્રોને સ્પર્શતાહોય તેવા સેવા અંતર્ગત કાર્યક્રમાંનું પ્રાથમિક શિક્ષકો માટે સંચાલન કરવું.</p> <p>૩. સંસ્થાની અન્ય બધી શાખાઓમાં શાખાઓ દ્વારા હાથ ધરતાકે શીખવાતા કાર્યક્રમો પ્રવૃત્તિઓને વિષયો જેટલી શીખવાતા ક્ષેત્રો જેટલી માહિતી પૂરી પાડવી.આવા કાર્યક્રમોમાં નીચેની બાબતોનો સમાવેશ થશે.</p> <p>(૧) પ્રારંભિક શિક્ષકો માટે સેવા અંતર્ગત કાર્યક્રમો.</p> <p>(૨) અશાલેય શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણના કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમ.</p> <p>(૩) સ્થાનિક રીતે પ્રસ્તુત હોય તેવો પાડયક્રમ, અધ્યયન અધ્યાપન સામગ્રી, અત્ય ખર્ચવાળી અધ્યાપન સામગ્રી, પરીક્ષણ અને મૂલ્યાંકન સાધનો પ્રોફોગ્ઝિક્ઝ વગેરેનો વિકાસ.</p> <p>(૪) ક્ષેત્રીય આંતરરક્ષિત વિસ્તરણ સહિત) પ્રવૃત્તિઓ.</p> <p>(૫) અભાવગ્રસ્ત જૂથોના બાળકોની શીખવાની બાબતમાં અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના શિક્ષણમાં સુધારો થાય તે રીતે કાર્ય સંશોધન.</p>	<p>પ્રવર વ્યાખ્યાતા-૧ (બાળમનોવિજ્ઞાન અંગે વિશેષજ્ઞતા ધરાવતા હોવા જોઈએ.)</p> <p>વ્યાખ્યાતા - ૮ વ્યાખ્યાતાઓનું વિષયવાર વિભાજન નીચે મુજબ રહેશે.</p> <p>(૧) જિલ્લામાં પ્રારંભિક કક્ષાએ શીખવાતી ભાષાઓ.</p> <p>(૨) ગણિતશાસ્ત્ર</p> <p>(૩) પર્યાવરણનો અભ્યાસસમાજી વજાન</p> <p>(૪) પર્યાવરણ વિષયક અભ્યાસ- વિજ્ઞાન</p> <p>(૫) કાર્યાનુભવ</p> <p>(૬) કલાશિક્ષણ</p> <p>(૭) આરોગ્ય અને વ્યાયામ શિક્ષણ</p> <p>શિક્ષણનો પાયો-૧</p> <p>ગણિતશાસ્ત્ર-૧</p> <p>વિજ્ઞાન-૧</p> <p>સમાજવિજ્ઞાન/સમાજવિદ્યા-૧</p> <p>કલા શિક્ષણ-૧</p> <p>વ્યાયામ શિક્ષણ-૧</p> <p>પ્રયોગશાળા સહાયક-૧</p> <p>નોંધ: કલા શિક્ષણના ક્ષેત્રમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને દર્શય અને અભિનયકલા વિદ્યાશાળાના સભ્યોની જરૂર પડ્યો. કલાશિક્ષણના વ્યાખ્યાતા બેમાંથી એક જ કલામાં નિપૂણ હશે તો અન્ય ક્ષેત્ર માટે ખંડ સમયના ઘોરણે કુશળ વ્યક્તિને કામે રોકી શકશે.</p>	

શાખા	કર્તવ્યો	કર્મચારીને નિયુક્ત કરવાની પદ્ધતિ
૧	૨	૩
	<p>૪. વિજ્ઞાન પ્રયોગશાળા, મનોવૈજ્ઞાનિક સાધનો, અશક્ત બાળકો માટેનો શિક્ષણ સાધન ખંડ, કલા શિક્ષણ ખંડ અને રમતગમત અને વ્યાયામ શિક્ષણની સામગ્રી અને સુવિધાઓની જાળવણી કરવી.</p> <p>૫. ચર્ચાસભા અને વક્તૃવ્ય, સાહિત્ય, વિજ્ઞાનમેળા, દર્શય અને અભિનય કલાઓ, રમતગમત અને વ્યાયામ શિક્ષણરૂપ્યાઓઓ, યોગ, શોખ વગેરે જેવી શાખાની મોટી કામગીરીઓને લગતી ક્ષેત્રોમાં સહપાઠયદમ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું અને તેને સહાય આપવી.</p> <p>૬. જિલ્લામાં આવેલ પી.ટી.સી. (ડી.એલ.એડ.) કોલેજોનું શૈક્ષણિક નિરીક્ષણ કરવું.</p>	
૨. કાર્યાનુભવ શાખા(WE) (Work Experience)	<p>૧. સંબંધિત કાર્ય અનુભવના સ્થાનિક ક્ષેત્રો મુકર્ર કરતા અને સંબંધિત કેન્દ્રવર્તી શાખાઓ સાથે સહયોગ સાધીને આવા ક્ષેત્રમાં નમૂનારૂપ પાઠ્યદમ એકમો, અધ્યાપન અને અધ્યયન સામગ્રી, ઓછા ખર્ચના અધ્યાપન સાધનો અને મૂલ્યાંકન સાધનો/તકનીકો વિકસાવવા.</p> <p>૨. શૈક્ષણિક તંત્રો અને પ્રારંભિક શાળાઓ, અશાલેય શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ કેન્દ્રોને આવી શાળા/કિન્ડરોમાં કાર્ય અનુભવની પ્રવૃત્તિઓના આયોજિત પ્રવેશ માટે સહાય કરવી.</p> <p>૩. ઉક્ત (૨)ના ટેકમાં કાર્યાનુભવના ક્ષેત્રમાંના શિક્ષકો માટે સેવા અંતર્ગત યોગ્ય કાર્યક્રમોનું સંચાલન કરવું.</p> <p>૪. સંસ્થાના અન્ય બધા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દા.ત. શિક્ષકો માટે પૂર્વસેવા અંતર્ગત કાર્યક્રમો, અશાલેય શિક્ષણ અને પ્રૌઢશિક્ષણના કર્મચારીઓ માટે તાલીમી કાર્યક્રમ, ક્ષેત્રીય આંતરરાષ્ટ્રીય (વિસ્તરણ સહિત) પ્રવૃત્તિઓ, કાર્ય સંશોધન વગેરોમાં કાર્ય-અનુભવને લગતી માહિતી પૂરી પાડવી.</p> <p>૫. સંસ્થાના મકાન વિસ્તાર-માર્ગો, રમતનું મેદાન, લોન, બળીયો વગેરે અને તેની આસપાસના વિસ્તારની સ્વચ્છતા, સંસ્થાનું ફર્નિચર અને અન્ય મિલકતના બુનિયાદી નિભાવ અને વિકાસ, સામાન્ય દેખભાગ માટેની પ્રવૃત્તિઓનું સંચાલન કરવું.</p> <p>૬. તાલીમી કાર્યક્રમના એકભાગ તરીકે કાર્ય કેન્દ્રો ખાતે સમૂહ સેવા પ્રવૃત્તિઓ અને અભ્યાસેતર મુલાકાતોનું આયોજન કરવું અને અભ્યાસેતર ધોરણે આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું.</p> <p>૭. કાર્યાનુભવ પ્રવૃત્તિઓ માટે કાર્યશાળા/ખેતર/ બળીયાની જાળવણી કરવી.</p> <p>૮. સંસ્થાના તાલીમાર્થીઓમાં કાર્યને લગતી શોખની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું</p>	<p>સિનિયર વ્યાખ્યાતા-૧ વ્યાખ્યાતા - ૧ કાર્ય-અનુભવ-૧ કાર્યશિક્ષક/કાફિટ/પ્રશિક્ષક (હસ્તકલા / વ્યવસાય / બાળાયત વગેરેના નિષ્ણાત) ખંડ સમય માટે હસ્તકલા કારીગરો, માણી વગેરેની સેવાઓ લઈ શકાય.</p>

શાખા	કર્તવ્યો	કર્મચારીને નિયુક્ત કરવાની પદ્ધતિ
૧	૨	૩
૩. જિલ્લા સંસાધન એકમ (DRU) (District Resource Unit)	<p>૧. સમગ્ર જિલ્લામાં અશાલેય શિક્ષણના કર્મચારી વર્ગ માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન અને સંકલન કરવામાં શિક્ષણ સત્તાવિકારીઓને સહાય કરવી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બહારના આવા કાર્યક્રમોના સંચાલનમાં જરૂરી સહાય પૂરી પાડવી.</p> <p>૨. નીચેના કાર્યક્રમોના સંચાલન માટે કેન્દ્રવર્તી શાખા તરીકે સેવાઓ પૂરી પાડવી.</p> <p>(૧) જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં આયોજન થનાર અશાલેય શિક્ષણના પ્રશિક્ષણો અને અયેક્ષણો પ્રેરકોને પ્રેરણા તાલીમ અને નિરંતર શિક્ષણનો કાર્યક્રમ (૨) નીચે પ્રમાણેની સાધનરૂપ વ્યક્તિત્વો માટે સંસ્કરણ કાર્યક્રમો: (ક) જિલ્લામાં (૧) અન્ય કેન્દ્રો ખાતે દર્શાવેલ કાર્યક્રમોનું જે સંચાલન કરે તે (એટલે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બહાર)</p> <p>દા.ત.નાફેરુ યુવક કેન્દ્ર, અશાલેય શિક્ષણ પરિયોજના, બિન સરકારી સંગઠનો વગેરેના કર્મચારીઓ.</p> <p>(૮) સમગ્ર /અશાલેય શિક્ષણ કાર્યક્રમોના સંપૂર્ણ સફળ અમલ માટેસાધનરૂપ વ્યક્તિત્વો, દા.ત. વિકાસ વિભાગના વિસ્તરણ અધિકારીઓ, સાર્વજનિક નેતાઓ, નિવૃત શિક્ષકો, માજ સૈનિકો, એન.એસ.એસ.ના સ્થયંસેવકો, સંકલત બાળ વિકાસ યોજના અધિકારીઓ કાર્યલક્ષી અક્ષરજ્ઞાનના સમૂહ કાર્યક્રમો સાથે સંકળાયેલ અન્ય વ્યક્તિત્વો.</p> <p>૩. (૧) અશાલેય શિક્ષણમાં જરૂરી સાહિત્ય સામગ્રી, ઉદ્દેશો, પદ્ધતિ વિજ્ઞાન, મૂલ્યાંકનો, સમર્યાદાઓ વગેરે જેવા ઉક્ત કાર્યક્રમોના હાર્દિક્રૂપ ક્રેત્રો તેમજ</p> <p>(૨) કર્મચારી વર્ગ ખાસ કરીને ભાષા, અંકગણિતના શિક્ષણમાં અને કાર્યલક્ષી કૌશલમાં જરૂરી ભૂમિકા ધરાવે તે માટે આવા વિષયો/ક્રેત્રોને લગતી માહિતી પૂરી પાડવી.</p> <p>૪. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં અને તેની બહાર ગોઠવવામાં આવેલ અશાલેય શિક્ષણના કર્મચારીઓના તાલીમ કાર્યક્રમની ગુણવત્તા અને અસરકારકતાનું મૂલ્યાંકન કરવું અને દેખરેખ રાખવી અને તેમાં નિરંતર સુધારણા થાય તે માટે પ્રયત્નો કરવા.</p> <p>૫. સંસ્થા ખાતે તાલીમ લેતા અશાલેય શિક્ષણના તમામ કર્મચારી વર્ગ અંગે માહિતી - આધારની જાળવણી કરવી અને આવી તાલીમને સુસંગત અનુવત્તી પ્રવૃત્તિઓનું સંચાલન કરવું</p> <p>૬. અશાલેય શિક્ષણ માટે પાઠ્યક્રમ, બુનિયાદી અને અક્ષરજ્ઞાન પછીનું અધ્યાપન-અધ્યયન સામગ્રી, ખર્ચ અધ્યાપન અને મૂલ્યાંકન સાધનો સામે અન્ય સંબંધિત શાખાઓની મદદ લઈને અનુવત્તી પ્રવૃત્તિઓ હાથ ધરવી. (૧) હાલના પાઠ્યક્રમ એકમો અધ્યાપન-અધ્યયન સાધનોને સ્થાનિક જરૂરિયાતને અનુરૂપ બનાવવા. (૨) જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં બોલાતી બોલીઓ સહિત સ્થાનિક રીતે પ્રસ્તુત હોય એવી નવી</p>	<p>ઉપાયાર્થ કે સિનિયર વ્યાખ્યાતા-૧ (બંને હોય કે બેમાંથી એક હોય તે પર આધારિત) વ્યાખ્યાતા - વેક્ટિપક અશાલેય શિક્ષણ-૨ રિસ્ટિ માટે વ્યાખ્યાતા પ્રોફ શિક્ષણ-૨ કારકુન-૨ જિલ્લા સંસાધન એકમમાં બે કારકુન હોય તો બેમાંથી એક ઉપાયાર્થના સ્ટેનો ટાઇપીસ્ટ તરીકે સેવા બજાવશે.</p>

	બાબતો વિકસાવવી.	
શાખા	કર્તવ્યો	કર્મચારીને નિયુક્ત કરવાની પદ્ધતિ
૧	૨	૩
	<p>૭. જિલ્લાના અશાલેય શિક્ષણ પરિયોજનાઓને કેન્દ્રો સામે કેન્દ્રીય આંતરકિયા (વિસ્તારણ સહિત) હાથ ધરવી અને કેતે દારા અશાલેય શિક્ષણના વિસ્તારમાં ઊભી થયેલ શૈક્ષણિક સમસ્યાઓ માટે સંદર્ભ એકમ તરીકે કામગીરી કરવી.</p> <p>૮. અશાલેય શિક્ષણ માટે માધ્યમોની સહાય લેવા માટે જિલ્લા શિક્ષણ બોર્ડ અને અશાલેય શિક્ષણ તંત્રને મદદરૂપ થવું.</p> <p>૯. અશાલેય શિક્ષણ વધુ અસરકારક બનાવવા માટે અન્ય શાખાઓના જરૂરી હોય તેટલા સહયોગથી સંબંધિત બધા જ કેતોમાં કાર્ય સંશોધન હાથ ધરવું.</p> <p>૧૦. સંસ્થાના ઉપર નહી દર્શાવેલ તમામ કાર્યક્રમોમાં ખાસ કરીને શિક્ષકો માટે પૂર્વસેવા અને સેવા અંતર્ગત શિક્ષણ કાર્યક્રમોમાં અશાલેય શિક્ષણને લગતી માહિતી પૂરી પાડવી.</p>	
શાખા	કર્તવ્યો	કર્મચારીને નિયુક્ત કરવાની પદ્ધતિ
૧	૨	૩
૪. સેવા અંતર્ગત કાર્યક્રમો, કેન્દ્રીય આંતરકિયા અને નાવીન્ય સંકલન શાખા (IFIC) (In-service programmes, Field Interaction and Innovation Coordination)	<p>૧. સમગ્ર જિલ્લામાં પ્રારંભિક શિક્ષકો માટેના સેવા અંતર્ગત શિક્ષણ કાર્યક્રમોના આયોજન અને સંકલનમાં શૈક્ષણિક તંત્રને સહાય કરવી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં આયોજિત કરેલ કાર્યક્રમનું આયોજન અને સંકલન કરવું આ શાખા તેની કામગીરીને અનુરૂપ નીચેની કામગીરી કરશે.</p> <p>(૧) જિલ્લામાં પ્રારંભિક શિક્ષકોની તાલીમ જરૂરિયાતને મુકરર કરી આવી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભાવિલક્ષી આયોજન તૈયાર કરશે.</p> <p>(૨) જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં આયોજન કરવાના તમામ કાર્યક્રમોની વાર્ષિક યાદી તૈયાર કરશે.</p> <p>(૩) જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બહારના યોજવાના સેવા અંતર્ગત કાર્યક્રમોનું વાર્ષિક સમયપત્રક તૈયાર કરવામાં સંબંધિત તંત્રોને મદદ કરવી.</p> <p>૨. નીચેની કામગીરીના સંચાલન માટે કેન્દ્રવત્તી શાખા તરીકે સેવા આપવી.</p> <p>(૧) કોઈ એક શાખા સાથે જેના વિષયો સંપૂર્ણપણે કે મુખ્યત્વે સંકળાયેલા ન હોય જેમકે સાપેક્ષ રીતે સામાન્ય સાર્વનિક પ્રકારના કાર્યક્રમો જેવા ભવન ખાતેના શિક્ષકો અને આચાર્યા માટેના સેવા અંતર્ગત બધા જ શૈક્ષણિક કાર્યક્રમો.</p> <p>(૨) જિલ્લામાં અન્ય મથકો ખાતે એટલે કે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન બહાર શિક્ષકો માટે સેવા અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરનાર સાધનરૂપ વ્યક્તિઓ માટે સંકરણ કાર્યક્રમો.</p> <p>(૩) દૂર દૂર સંપર્ક પદ્ધતિ દ્વારા શિક્ષકો માટેના સેવા અંતર્ગત શૈક્ષણિક કાર્યક્રમો.</p>	<p>પ્રવર વ્યાખ્યાતા-૧ વ્યાખ્યાતા - ૧ કારકુન-૧</p>

	<p>૩. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની અંદર અને બહાર યોજાતા સેવા અંતર્ગત કાર્યક્રમોની ગુણવત્તા અને અસરકારકતાનું મૂલ્યાંકન કરવું અને દેખરેખ રાખવી. અને તેમાં સતત સુધારણા કરવા પ્રયત્નો કરવા.</p> <p>૪. પ્રૌઢ શિક્ષણ / અશાલેય શિક્ષણ સિવાયના જે કર્મચારીઓ સંસ્થામાં તાલીમ લેતા હોય તેમના માહિતી આધારની જાળવણી કરવી અને આપી તાલીમને લક્ષ્યમાં લઈને પત્રવ્યવહાર, મુલાકાતો, મુદ્રિત સામગ્રીની વહેંચણી વગેરે દ્વારા અનુવર્તી પ્રવૃત્તિઓ હાથ ધરવી.</p> <p>૫. જે શિક્ષકો તેમનું શિક્ષણ ચાલુ રાખવા ઈમછતા હોય તેમના માટે સંદર્ભ અને સહાય કેન્દ્ર તરીકે સેવાઓ પૂરી પાડવી.</p> <p>૬. બધા જ કાર્ય સંશોધન અને સાચેસાથ જેમાં નીચેનાણો સમાવેશ થાય છે તેવી સંસ્થામાં ક્ષેત્રીય આંતરકિયા પ્રવૃત્તિઓ માટે કેન્દ્રવર્તી શાખા તરીકે કામગીરી કરવી.</p> <p>(૧) મકાનની અંદર હાથ ધરાતી કાર્ય સંશોધન પ્રવૃત્તિઓનું સંકલન કરવું અને તેના પરિણામોનો ફેલાવો કરવો.</p> <p>(૨) હાથ ધરાતા હોય ત્યાં પ્રારંભિક શિક્ષણના ક્ષેત્રમાં અભ્યાસ સંશોધનો, નાવીન્ય વગેરેના પરિણામો અંગેની માહિતી માટે કલીયરોગ હાઉસ તરીકે કામગીરી કરશે.</p> <p>(૩) નિયતકાલીન સમાચારપત્ર તથા સંસ્થાનું મુખ્યપત્ર બહાર પાડી જિલ્લાની બધી જ પ્રારંભિક શાળાઓ /અશાલેય શિક્ષણ/ પ્રૌઢ શિક્ષણ કેન્દ્રોને મોકલી આપવા.</p>	
શાખા	કર્તવ્યો	કર્મચારીને નિયુક્ત કરવાની પદ્ધતિ
૧	૨	૩
૫. પાઠ્યકક્ષમ સામગ્રી વિકાસ અને મૂલ્યાંકન શાખા (CMDE) (Curriculum, Material Development and Evaluation)	<p>૧. હાલની બાબતોને સ્વીકારવી અને નીચેના પ્રકારની નવી બાબતો વિકસાવવી જેથી તે સ્થાનિક પરિસ્થિતિને અનુકૂલ થઈ શકે અને પ્રારંભિક શિક્ષકોના શિક્ષણ કાર્યક્રમમાં તેનો ઉપમોગ થઈ શકે.</p> <p>(૧) પાઠ્યકક્ષ એકમો: સામાન્યપણે નિયત કરેલ પાઠ્યકક્ષમાં વિવિધ વિષયોમાં ઉમરો કરવા જિલ્લા કક્ષાને સ્થાનિક રીતે સુસંગત એવો નવો એકમ વિકસાવી શકાય. સેવા એકમો ભૂગોળ, લોકસાહિત્ય, દંતકથા, રિવાજો, વન, વનસ્પતિ, પ્રાણીજીવન, મેળાઓ, હસ્તકલા, ભૂસ્તરશાસ્ત્ર વગેરે સાથે સંબંધ ધરાવતા હશે.</p> <p>(૨) સામાન્ય તેમજ ખાસ કરીને જિલ્લામાં આદિજાતિની વસ્તી વધારે હોય ત્યાં પહેલાં અને બીજા પોરણના પ્રારંભિક વર્ગોમાં આદિજાતિઓની ભાષામાં સ્થાનિક રીતે વિકસાવેલ અભ્યાસક્રમ એકમોનું શિક્ષણ આપવું</p> <p>(૩) નિરંતર અને એકંદર અધ્યોત્તમી મૂલ્યાંકન માટેની તકનીકી અને માર્ગદર્શન.</p> <p>(૪) કસોટી, પ્રશ્ન/ બાબત બેંક, દર, માપ, અવલોકન, અનુસૂચિ નિદાન કસોટીઓ / ઉપચારાભંક કાર્યક્રમો માટે માર્ગદર્શક સિધ્યાંતો, પ્રતિભા ખોજ પ્રક્રિયા વગેરે. અન્ય સંબંધિત વિદ્યાશાખાઓ, સંસ્થાઓ, તજ્શો,</p>	સિનિયર વ્યાખ્યાતા-૧ વ્યાખ્યાતા - ૧ બે કર્મચારી વર્ગના સભ્યોમાંથી એકની પાસે વિજ્ઞાન/ગણિતની જાણકારી હશે અને બીજા પાસે સમાજવિજ્ઞાન માનવવિદ્યાઓની જાણકારી હશે.

	<p>શિક્ષકો અને પ્રશિક્ષકોનો સહયોગ લઈને ઉપર મુજબના મોટાભાગના અનુકૂળ બનાવેલા વિકાસના કામો.</p> <p>૨. પ્રૌઢ અને અશાલેય શિક્ષણ માટે ઉપરોક્ત વિકાસ કામોમાં જિલ્લા સંસાધન એકમને મદદરૂપ થવું.</p> <p>૩. પ્રાથમિક અને ઉપર્યુક્ત કક્ષા તથા રાખ્યીય સાક્ષરતા મિશન ડેફન ખાસ કરીને પ્રૌઢ અક્ષરજ્ઞાન લેનારાઓ માટે નિયત કરેલ લઘુ મંજ કક્ષાના સંદર્ભમાં શીખનારાઓની સિદ્ધિની આકારણી કરવા માટે નમૂના આધારિત કસોટીઓ હાથ ધરવી.</p> <p>૪. શીખનારા અને મૂલ્યાંકનની વિશ્વસનીય અને અધિકૃત પદ્ધતિ દાખલ કરવામાં શૈક્ષણિક તત્ત્વો તથા પ્રારંભિક શાળા અશાલેય શિક્ષણ પ્રૌઢ શિક્ષણ કેન્દ્રોને મદદ કરવી.</p> <p>૫. અભ્યાસક્રમ, સામગ્રી વિકાસ અને મૂલ્યાંકનને લગતા સેવા અંતર્ગત કાર્યક્રમમાં હોય છે એ મુજબ પણ ઉક્ત ૧ માં દર્શાવેલ અનુકૂળ બનાવેલા વિકસિત કરેલા કામો માટે કાર્યશાળાનું સંચાલન કરવું</p> <p>૬. ભવનના બધા જ કાર્યક્રમો/પ્રવૃત્તિઓમાં અભ્યાસક્રમ, સામગ્રી વિકાસ અને મૂલ્યાંકનને લગતી માહિતી પૂરી પાડવી. દા.ત. શિક્ષકો માટે પૂર્વ સેવા અને સેવા અંતર્ગત કાર્યક્રમો,</p> <p>અશાલેય/પ્રૌઢ શિક્ષણના કર્મચારી વર્ગ માટે તાલીમ, ક્ષેત્રીય આંતરરંધ્રીય પ્રવૃત્તિઓ કાર્ય સંશોધન વગેરે.</p>	
શાખા	કર્તવ્યો	કર્મચારીને નિયુક્ત કરવાની પદ્ધતિ
૧	૨	૩
E. શૈક્ષણિક પ્રોફેઝ્યોલોજીકિશાખા (ET) (Educational Technology)	<p>૧. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સંબંધિત કર્મચારી વર્ગ અને અન્ય સાધનરૂપ વ્યક્તિઓના સહયોગથી પ્રારંભિક શિક્ષણ અને પ્રારંભિક શિક્ષક શિક્ષણને લગતા વિવિધ વિષય / ક્ષેત્રો માટે સરળ, અસરકારક અને ઓછી કિમતના શૈક્ષણિક સાધનો જેવા કે આવેખ, આકૃતિ, નમૂનાઓ, ફોટોગ્રાફ, સ્લાઇડ, શ્રવણ ટેપ, નાટક-લેખન, ગીતો વગેરે વિકસાવવા.</p> <p>૨. પ્રૌઢ/અશાલેય શિક્ષણ માટે ઉપર મુજબના ઓછા ખર્ચના શૈક્ષણિક સાધનો વિકસાવવામાં જિલ્લા સંશાધન એકમને મદદ કરવી.</p> <p>૩. નીચેની બાબતોની જાળવણી કરવી.</p> <p>(૧) ભવનના બધા જ દર્શય-શ્રાવ્ય સાધનો.</p> <p>(૨) કમ્પ્યુટર પ્રયોગશાળા.</p> <p>(૩) ભવનમાં તેમજ સંસ્થા બહાર વિકસાવવામાં આવેલ સારા ઓછા ખર્ચના શૈક્ષણિક સાધનો માટે પ્રદર્શન સ્થળ.</p> <p>(૪) ભવન પાસે ચલાયિત દર્શાવવાનું ફિલ્મ પ્રોજેક્ટર હોય તો શિક્ષણ સંબંધી દર્શય શ્રાવ્ય કેસેટના ગ્રંથાલય.</p> <p>૪. કેસેટ વગાડવાની અને ફિલ્મ બતાવવાની સુવિધાવાળી સંસ્થાઓને સ્લાઇડ, કેસેટ, ફિલ્મ ઉછીના આપવા અને પ્રાપ્તિ રથાનો પાસેથી તે ઉછીના મેળવવા.</p> <p>૫. જિલ્લાની પ્રારંભિક શાળાના વિદ્યાર્થીઓ, પ્રૌઢ</p>	<p>પ્રવર વાખ્યાતા-૧ વાખ્યાતા - ૧ તકનિકવિદ્ય-૧</p>

	<p>શિક્ષણ / અશાલેય શિક્ષણ મેળવનારા શિક્ષકો/પ્રશિક્ષકો વગેરે માટે શૈક્ષણિક પ્રસારણની વ્યવસ્થા કરવા નજીકના રેડિયો મથક સાથે સંપર્ક રાખવો.</p> <p>૬. નીચેની બાબતો પર ખાસ ભાર મૂકીને શૈક્ષણિક પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં શિક્ષકો માટે યોગ્ય સેવા અંતર્ગત કાર્યક્રમોનું સંચાલન કરવું.</p> <p>(૧) શૈક્ષણિક પ્રસારણ, દૂરદર્શન પ્રસારણ, કેસેટ અને સહાયક સાધનોનો અસરકારક ઉપયોગ અને</p> <p>(૨) સરળ, ઓછા ખર્ચવાળા શૈક્ષણિક સાધનોનો વિકાસ.</p> <p>૭. ઉક્ત (૧)માં દર્શાવેલ વિકાસ કામો માટે કાર્યક્રમાઓનું સંચાલન કરવું.</p> <p>ભવનના અન્ય બધા જ કાર્યક્રમો / પ્રવૃત્તિઓમાં શૈક્ષણિક પ્રૌદ્યોગિકીને લગતી માહિતી પૂરી પાડવી, જેવી કે શિક્ષકો માટે પૂર્વસેવા અને સેવા અંતર્ગત કાર્યક્રમો, અશાલેય શિક્ષણ/પ્રૌઢ શિક્ષણના કર્મચારી વર્ગો માટે તાલીમ કાર્યક્રમો, ક્ષેત્રીય આંતરકિયા પ્રવૃત્તિઓ, સામગ્રી વિકાસ, કાર્ય સંશોધન વગેરે.</p>	
શાખા	કર્તવ્યો	કર્મચારીને નિયુક્ત કરવાની પદ્ધતિ
૧	૨	૩
૭. આયોજન અને વ્યવસ્થાપન શાખા (P & M) (Planning & Management)	<p>૧. પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રીકરણ/ પ્રારંભિક શિક્ષણનું સાર્વત્રીકરણ / રાષ્ટ્રીય સાક્ષરતા કાર્યના લક્ષ્યાંકો સિદ્ધ કરવા વિવિધ આયોજનના અમલની જરૂરિયાત હોય તેવા જિલ્લાઓ માટે અને આવા લક્ષ્યાંકો સિદ્ધ કરવા થયેલ પ્રગતિની દેખરેખ માટે યોગ્ય માહિતી-આધાર જાળવવો.</p> <p>૨. પ્રારંભિક શિક્ષણનું સાર્વત્રીકરણ / રાષ્ટ્રીય સાક્ષરતા કાર્યના શૈક્ષણિક આયોજણો / વહીવટકારો / જિલ્લા શિક્ષણ બાર્ડને નીતિ વિષયક સલાહ આપવા અભ્યાસો હાથ ધરવા. નવા અભ્યાસો માટેના કેટલાક મહત્વના ક્ષેત્રો નીચે મુજબ છે.</p> <p>(૧) બાળકો અને શીખનારા પ્રૌઢોના નામ દાખલ કરવા તેમનો અભ્યાસ જાળવી રાખવો અને તેમની હાજરીની નિયમિતતા અને એને અસરકર્તા પરિબળો.</p> <p>(૨) ઉપરોક્ત બાબતો અંગે દખલ કરતા વિવિધ (પ્રોત્સાહન સહિતની) અસર.</p> <p>(૩) બુનિયાદી શિક્ષણની પ્રક્રિયામાં લોકોની સમજ અને તેમાં તેમની ભાગીદારી.</p> <p>(૪) જિલ્લાની સંસ્થાઓના મૂલ્યાંકનો માટેના ધોરણો, માપદંડ અને તકનિકો વિકસાવવા.</p> <p>ઉક્ત અભ્યાસો અને સંખ્યાબંધ કાર્ય સંશોધન પ્રવૃત્તિ હાથ ધરવા માટે સરળતાપૂર્વક સંપર્ક કરી શકાય તેવા જિલ્લાના શૈક્ષણિક રીતે પછાત એવા એક કે બે વિસ્તારોને ખાસ પસંદ કરવામાં આવશે. આ વિસ્તારોને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રયોગશાળા વિસ્તાર તરીકે ઓળખવામાં આવશે. પ્રયોગશાળા વિસ્તારોમાં સંખ્યાબંધ અભ્યાસો હાથ ધરવામાં આવશે, એમ છતાં તે અભ્યાસો આ વિસ્તારો પૂરતા જ મર્યાદિત રહે તેવું જરૂરી નથી, તેમાં સમાવિષ્ટ થતા કામના પ્રકારને આધારે અન્ય યોગ્ય વિસ્તારોની પણ પસંદગી કરવામાં આવશે.</p> <p>૩. શૈક્ષણિક તંત્રોને (૧) શાખા નકશાકામ (૨)</p>	<p>પ્રખર વ્યાખ્યાતા-૧ વ્યાખ્યાતા - ૧ અંકડાશાસ્ત્રી-૧</p>

	<p>નિર્દિષ્ટ ક્ષેત્ર અને લક્ષ્યજૂથની નિર્દિષ્ટ પદ્ધતિ અંગે પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રીકરણ / એયુઈઈ માટે લઘુસ્તરીય આયોજન. (૩) શાળા સંકુલોનું નિર્માણ અને પ્રવૃત્તિ (૪) શાળા સંકુલો/શાળાઓ વગેરે માટે સંસ્થાગત આયોજન અને (૫) સંસ્થાકીય મૂલ્યાંકન માટે તકનિકી સહાય પૂરી પાડવી.</p> <p>૪. બુનિયાદી શિક્ષણમાં, લોડોની ભાગીદારીના તમામ કાર્યક્રમોના સંબંધમાં કેન્દ્રવર્તી શાખા તરીકે સેવા બજાવવી અને ખાસ કરીને જિલ્લા શિક્ષણ બોર્ડ, વ્યાવસાયિક શિક્ષણ કેન્દ્રોના સભ્યો, સમુદાયના નેતાઓ, યુવાનો અને અચ સૈપિએક શૈક્ષણિક કાર્યકરો માટે સંસ્કરણ કાર્યક્રમોનું સંચાલન કરવું.</p>
	<p>૫. નેતૃત્વ, પ્રેરણ, સમૂહની ભાગીદારી, શૈક્ષણિક વહીપટ, નાણાં વ્યવસ્થા અને છિસાબ, કચેરી કામગીરી પ્રાથમિક શિક્ષણના સાર્વત્રીકરણના આયોજન, સંસ્થાકીય આયોજન વગેરે ક્ષેત્રોને આપરી લઈ મુખ્ય શિક્ષકો, શાળા, સંકુલોના વડાઓ અને આયોજન અને વ્યવસ્થામાંના ઘટક કક્ષાના શૈક્ષણિક કાર્યકરો માટે યોગ્ય કાર્યક્રમોનું સંચાલન કરવું.</p> <p>૬. ખાસ કરીને પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રીકરણ / પ્રારંભિક શિક્ષણનું સાર્વત્રીકરણ અને રાષ્ટ્રીય સાક્ષરતા કાર્યના ઉદ્દેશોની સામે જિલ્લામાં અમલી બનાવાયેલા શૈક્ષણિક વિકાસના વિવિધ કાર્યક્રમોની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું.</p> <p>૭. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પંચવર્ષીય તથા વાર્ષિક સંસ્થાકીય આયોજનો અને વાર્ષિક સ્વમૂલ્યાંકન અહેવાલ તૈયાર કરવા માટે તથા જિલ્લા શિક્ષણ બોર્ડ સાથે સંપર્ક રાખવા માટે કેન્દ્રવર્તી શાખા તરીકે કામગીરી કરવી.</p> <p>૮. સંસ્થાના બધા જ કાર્યક્રમો / પ્રવૃત્તિઓ દા. ત. શિક્ષકો માટે પૂર્વ સેવા અને અંતર્ગત કાર્યક્રમો, અશાલેય શિક્ષણ /પ્રૌઢ શિક્ષણના કર્મચારી વર્ગ માટે તાલીમ કાર્યક્રમ, ક્ષેત્રીય આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ, કામગીરી સંશોધન વગેરેની બાબતમાં ખાસ કરીને ઉક્ત બાબત નં. ૩ માં દર્શાવેલ ક્ષેત્રોના સંદર્ભમાં આયોજન અને વ્યવસ્થા સંબંધી માહિતી પૂરી પાડવી.</p>

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન _ અમદાવાદ શહેર જિ.અમદાવાદ
વહીવટી કર્મચારીઓને નીચે મુજબ શાખાવાર કામગીરી વહેંચણી કરવામાં આવી છે.

કચેરી અધિક્ષક : (ઓડીટર ગ્રુપ-૧)

૧. કચેરીની દરેક શાખામાં થતી કામગીરીમાં સલાહસૂચનો કરવા તથા દેખરેખ રાખવી તથા કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તેની તકેદારી રાખવી.
૨. કચેરીના તમામ અધિકારીઓ/ કર્મચારીઓના ખાનગી અહેવાલ પોતાના કજા હેઠળ રાખવાના રહેશે.

મુખ્ય કારકુન : (વહીવટી)

૧. વહીવટી શાખા-૧ અને ૨ શાખાની કામગીરીમાં માર્ગદર્શન આપવું તથા દેખરેખ રાખવી.
૨. વહીવટી શાખાની સંપૂર્ણ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તેની કાળજી રાખવાની રહેશે.

મુખ્ય કારકુન : (હિસાબી)

૧. હિસાબી શાખા-૧ અને શાખાની કામગીરીમાં માર્ગદર્શન આપવું તથા દેખરેખ રાખવી.
૨. હિસાબીશાખાની સંપૂર્ણ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તેની કાળજી રાખવાની રહેશે.

હિસાબી શાખા-૧ કામગીરી

૧. સંસ્થાના તમામ અધિકારી/કર્મચારીઓના પગાર બીલો બનાવવા/ વટાવવા અંગેની કામગીરી.
૨. કેશબુક નિભાવવી.
૩. કચેરી કન્ટીજન્સી બીલ બનાવી વટાવવું અને ચૂકવણી કરવી.
૪. જે તે કર્મચારીઓના ટી.એ. બીલો તિજોરી કચેરીમાં રજૂ કરી, વટાવી ચૂકવણું કરવું
૫. સંસ્થાની સામાન્ય ગ્રાન્ટનો (તાલીમ-ઈડીએન યોજના સિવાયની) હિસાબ રાખવો. જરૂરી રજીસ્ટર નિભાવવું.
૬. અંદાજપત્રક/ખર્ચપત્રક મોકલવું.
૭. અધિકારી/કર્મચારીઓના જપીએફ/પાર્ટફાઈનલ/એડવાન્સ ઉપાડના બીલો તૈયાર કરી વાટાવવા/ચૂકવવાની કામગીરી.
૮. હિસાબી શાખામાંથી આવેલ તૈયાર એઝ્સ્ટ્રેક્ટ બીલ વટાવી જે તે અધ્યાપકશ્રીને નાણાં ચૂકવવા.
૯. સર્વીસ સ્ટેમ્પ ઇન્ટેન્ટ મુજબ બીલ બનાવી તિજોરીમાં વટાવી સંબંધિત ટેબલને પોસ્ટ ટિકીટ ખરીદવા નાણાં ચૂકવવા.
૧૦. અધિકારી/કર્મચારીઓની પે સ્લીપ તૈયાર કરવી.
૧૧. સરકારી કચેરી/ખાતા અને સરકારશી તરફથી યોજાતા તમામ તાલીવગ્રો, સેમીનાર અંગેની કામગીરી તથા વિષયવાર તાલીમ સેમીનાર રજીસ્ટર/હિસાબો તૈયાર કરવા અંગેની કામગીરી.
૧૨. સેમીનાર/તાલીમવગ્રો માટે આપેલ ગ્રાન્ટમાંથી નાણાં ઉગાવવા, ઉચ્ચક બીલ/વિગતવાર બીલ બનાવી હિસાબી-૧ શાખાને આપવા તથા જે તે ગ્રાન્ટનો હિસાબ રાખવો. જરૂરી રજીસ્ટર નિભાવવું.
૧૩. ખાન યોજનાની માહિતી તૈયાર કરવી. ત્રિમાસિક પત્રકો મોકવા તથા રજીસ્ટર નિભાવવાની કામગીરી.

૧૪. સેમીનાર/તાલીમવર્ગની તમામ આંકડાકીય માહિતી તથા રજીસ્ટર નિભાવવું.
૧૫. ક્યેરીની P & M શાખા સાથે ચર્ચા વિચારણા કરી તાલીમ અંગેનું આયોજન કરવું.
૧૬. S.S.A.તાલીમ ખર્ચ/હિસાબ અંગેની કામગીરી.
૧૭. દરેક તાલીમ વર્ગપૂરો થયેથી સંબંધિત વ્યાખ્યાતા પાસેથી ખર્ચ/હિસાબની ફાઈલ મેળવી રેકર્ડ પર રાખવી.
૧૮. ૧૧-૪ ના કર્મચારીઓના ગણવેશ, ચંપલ, ગરમ કોટના બીલો બનાવી તિજોરીમાં મોકલવા.
૧૯. તાલીમ/સેમીનાર અંગેની હિસાબી તમામ કામગીરી.

વહીવટી શાખા-૧ કામગીરી

૧. કચેરીના તમામ અધિકારી/કર્મચારીઓની અસલ સેવાપોથી રાખવી/નિભાવવી અને તેમાં વખતોવખત જરૂરી નોંધ કરવી.
૨. કચેરીના તમામ અધિકારી/કર્મચારીઓની તમામ પ્રકારી રજાઓ-ઇજાફાઓ મંજૂર કરવાની કામગીરી.
૩. નવી જગ્યાઓ મંજૂરી કરાવવી, હંગામી જગ્યાઓ ચાલુ રાખવા તથા હંગામી જગ્યાઓ કાયમી કરવા અંગેનો પત્રવ્યવહાર કરવાની કામગીરી.
૪. અધિકારી/કર્મચારીઓના ખાનગી અહેવાલ મંગાવવા, મોકલવા, જાળવવા અંગેની કામગીરી.
૫. મહેકમ અંગેની તમામ કામગીરી.
૬. ઉત્સવ ઉજવણી અંગેની કામગીરી.
૭. કચેરીમાં આવતી જતી ટપાલની નોંધણી કરવી તથા તે અંગેના જરૂરી રજીસ્ટરો નિભાવવા.
૮. ટપાલ ટિકીટોનું ઇન્ડેન્ટ તૈયાર કરી હિસાબી-૧ શાખાને આપવું ટિકીટ મેળવી સ્ટેમ્પ રજીસ્ટર નિભાવી હિસાબ રાખવો.
૯. વર્ગ-૪ ના કર્મચારીઓના ગણવેશ, ચંપલ ગરમકોટ વગેરે પૂરા પાડવાની કામગીરી.
૧૦. સરકારી પ્રેસ વડોદરા/રાજકોટમાંથી સ્ટેશનરી/સ્ટાન્ડર્ડ ફોર્મ તથા અન્ય સાહિત્ય મેળવવાની કામગીરી તથા રજીસ્ટર્સ નિભાવવા.
૧૧. શાળાના પ્રવેશોત્સવ અંગેની કામગીરી તથા ઉત્સવ ઉજવણી અંગે વહીવટી શાખાને મદદરૂપ કામગીરી કરવી.

મુદ્રા નં. ૩

દેખરેખ અને જવાબદારીના માળખાને માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ પોતાની શાખાને લગતી વિવિધ કામગીરી કરેલી કાર્યપદ્ધતિ અનુસાર કરે છે. કરેલીમાં આવતી તમામ ટપાલોને શાખાવાર ફાળવણી કરી તેની નિયત રજીસ્ટરમાં નોંધણી કરવામાં આવે છે. ત્યારબાદ જે તે શાખાને ટપાલ આગળની કામગીરી અર્થે વહેંચવામાં આવે છે. જે તે શાખાના કર્મચારીઓ પોતાને ફાળવેલ ટપાલ પર જરૂરી કાર્યવાહી-આયોજન કરી તે કરેલી અધિક્ષક મારફત અધિકારીશ્રી પાસે રજૂ કરે છે. અધિકારીશ્રી તરફથી સંમતિ મળ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવે છે.

મુદ્રા નં.:૪

પોતાના કાર્યો બજાવવા માટે પોતે નક્કી કરેલા ધોરણો.

૧. કરેલી કાર્ય પદ્ધતિ મુજબ કામગીરી કરવામાં આવે છે.
૨. ગુજરાત સેવા વર્તણૂક નિયમો (શિસ્ત-અપીલ) ૧૯૭૧ મુજબ કર્મચારીઓએ કામગીરી કરવાની હોય છે.
૩. દરેક કર્મચારીએ પોતાને સૌંપેલ કામગીરી નિયત સમયમર્યાદામાં પૂરી કરવાની હોય છે.
૪. કરેલીનો સમય સવારે ૧૦-૩૦ થી સાંજે ૬-૧૦ સુધીનો હોય છે. (સોમવાર થી શુક્રવાર) દર શનિવારે કરેલીનો સમય સવારે ૭-૩૦ કલાકથી ૧૨-૦૦ સુધીનો હોય છે.
૫. કરેલીના પ્રાચાર્યશ્રી અને શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક કર્મચારીઓ પ્રસંગોપાત ટેલીકોન્ફરન્સ તથા વિડીયો કોન્ફરન્સમાં હાજર રહી વડી કરેલીના સંપર્કમાં રહે છે.

મુદ્દા નં.: ૫

પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમ સંગ્રહો અને રેકર્ડ.

ક્રમ	કામગીરી	આધાર સંદર્ભ
૧	સેવાકલીન, સંશોધન અને ઈડીએન-૧૨ સદર અંતગત તાલીમ વર્ગો	(૧) નાણાં વિભાગ, ગુ.રા. ગાંધીનગરના ઠરાવ એફ.એ.એચ.-૧૦૮૧-૩૭૭-૪ તા.૧૦/૦૪/૧૯૯૧ (૨) જીસીઈઆરટી, ગાંધીનગરના પરિપત્ર નં તાલીમવર્ગ/ખર્ચવિગત/૮૮૧૮-૮૮૬૮/ ૮૬-૮૭ તા.૨/૧૨/૮૬ તથા ૨૦૦૩- ૦૪ના વર્ષનું તાલીમ ખર્ચનું સુધારેલ બ્રેકઅપ (૩) જીસીઈઆરટી/૭૭૭૦-૭૮૧૨ તા. ૨૩ /૦૪/ ૨૦૧૦ ના વર્ષનું તાલીમ ખર્ચનું સુધારેલ બ્રેક અપ.

વહીવટી કામગીરી

ક્રમ	કામગીરી	આધાર સ્તંભ
૧	પગારબીલો બનાવવા, કન્ટીજન્સી બીલો, એબ્સ્ટ્રેક્ટ બીલો, મુસાફરી ભથ્થા બીલો, વિગતવાર બીલો તથા અન્ય બીલો બનાવવા.	(૧) ગુજરાત તિજેરી નિયમો. (૨) નાણાંકીય સત્તા સૌંપણી નિયમો ૧૯૮૮. (૩) નાણાં વિભાગ ગુ.રા., ગાંધીનગર વખતોવખત બહાર પાઠેલ પરિપત્રો અને ઠરાવો. (૪) વડી કચેરી ગાંધીનગરે ફાળવેલ ગ્રાન્ટના હુકમો.
૨	કચેરી તથા કર્મચારીઓની રજી, દૃજાક્ષા, એલ.ટી.સી. ચાર્જ એલાઉન્સ મંજૂર કરવા.	(૧) ગુજરાત મૂલ્કી સેવા સર્વિસ પે રુલ્સ-૨૦૦૨ (૨) ગુજરાત મૂલ્કી સેવા સર્વિસ પેન્શનરુલ્સ૨૦૦૨ (૩) ગુજરાત મૂલ્કી સેવા સર્વિસ લીવ રુલ્સ-૨૦૦૨ (૪) વખતો વખતના ઠરાવો.
૩	પગાર નિર્ધારણ અંગેની કામગીરી	ગુજરાત સરકાર, નાણાં વિભાગ ગુ.રા. ના ઠરાવ નં (જ.એન-૮) પીજાઆર ૧૦૦૮-૨-પે સેલ (મ) તારીખ: ૨૭/૦૨/૨૦૦૮
૪	ખાનગી અહેવાલ લગતી કામગીરી	સામાન્ય વહીવટી વિભાગનો ઠરાવ નં ખાલ/૧૦૮૮/ક/તા.૩૧/૩/૮૮ તથા વખતો વખતની સૂચનાઓ.
૫	કચેરીની કોઈ પણ પ્રકારની કામગીરી	સરકારશી તથા જીસીઈઆરટી, ગાંધીનગરે નક્કી કરેલ ધારાધોરણો તથા નિયમો

મુદ્રા નં : ૬

પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોનું વર્ગપત્રક:

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં વડી કચેરી-જીસીઈઆરટી, ગાંધીનગર દ્વારા
શિક્ષણ વિભાગ દ્વારા નિયત થયેલ વિવિધ કામગીરીના રજીસ્ટર્સ, માહિતી પત્રકો, માર્ગદર્શક
સૂચનાઓ, સેવાપોથીઓ વગેરે.

કામગીરી પૂર્ણ થયેથી રેકર્શની અગત્યતા ચકાસી તેનું “ક”, “ખ”, “ખ-૧”, “ગ”,
“ધ” વર્ગમાં વર્ગિકરણ.

ક વર્ગ - કાયમી-રેકર્ડ

ખ વર્ગ - ૩૦ વર્ષ

ખ-૧ વર્ગ- ૧૫ વર્ષ

ગ વર્ગ- ૦૫ વર્ષ

ધ વર્ગ - ૦૧ વર્ષ

મુદ્દા નં. ૭

પોલીસી (નીતિ વિષયક)ના ઘડતરમાં કે અમલના સંબંધમાં જનતા સત્યો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના દ્વારા માટેની વિદ્યમાન કોઈ વ્યવસ્થાની વિગતો.

જનતા સાથે વિચાર વિનિમય માટે વિદ્યમાન વ્યવસ્થાની વિગત નીચે મુજબ છે.

- | | |
|--|--|
| <ul style="list-style-type: none"> ❖ રાજ્ય કક્ષાની વ્યવસ્થા ❖ શિક્ષણ વિભાગ ❖ સામાન્ય વહીવટ વિભાગ ❖ નાણાં વિભાગ સમાજ કલ્યાણ વિભાગ ❖ જસીઈઆરટી, ગાંધીનગર | <ul style="list-style-type: none"> ❖ રાષ્ટ્રીય કક્ષાની વ્યવસ્થા ❖ MHRD ❖ NCERT ❖ NCTE ❖ UNICEF ❖ NUEPA |
|--|--|

તેમજ કેટલાક કિસ્સાઓમાં સંબંધિત કચેરી, વિભાગ દ્વારા થયેલ પોલીસીને અનુસરીને કચેરી કામગીરી તેમજ વિવિધ કામગીરી અંતગર્ત નિર્ણયો લેવાય છે. કચેરીના અધિકાર તંત્રમાં આવતી બાબતો, કામગીરી, અમલીકરણ ક્ષેત્રે સુલભ વહીવટ તેમજ ત્વરીત નિર્ણયમાં સહાયભૂત બને તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. જેમાં જિલ્લા કક્ષાએ નીચે મુજબ વ્યવસ્થા છે.

- ❖ ડાયટ
- ❖ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
- ❖ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી
- ❖ શાસનાધિકારીશ્રીની કચેરી
- ❖ સર્વ શિક્ષા અભિયાનની કચેરી
- ❖ રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાનની કચેરી

મુદ્રા નં. ૮

બોર્ડ તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ કાઉન્સિલ, સમિતિઓ અને બીજા મંડળોનું પત્રક અને તે બોર્ડ, કાઉન્સિલો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કમ અથવા તેની બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ;

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતી, શિક્ષકોની ફેરબદલી કેમ્પ માટે રચાયેલી સમિતિમાં પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન એ એક સત્યપદ ધરાવે છે.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની રચનામાં જે હેતુઓ, ઉદ્દેશો અભિપ્રેત છે તે અનુસંધાને બેઠકોની કાર્યનોંધો સામાન્ય જનતા માટે જાહેર કરવાના પ્રસંગો ખાસ ઊભા થતા નથી.

PAC (Programme Advisory Committee) ની બેઠક માટેની સમિતિમાં નીચે જણાવ્યા પ્રમાણેના હોદેદારો હોય છે.

૧.	જિલ્લા કલેક્ટર	અધ્યક્ષશ્રી
૨.	જિલ્લા વિકાસ અધિકારી	ઉપાધ્યક્ષશ્રી
૩.	પ્રાચાર્ય ડાયટ	સત્ય સચિવશ્રી
૪.	જિલ્લા શિક્ષણાધિકારીશ્રી.	સત્યશ્રી
૫.	જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી	સત્યશ્રી
૬.	ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરશ્રી, એસ.એસ.એ અને આર.એમ.એસ.એ	સત્યશ્રી
૭.	બે સિનિયર લેક્ચરર ડાયટ	સત્યશ્રી
૮.	બે શાળાના આચાર્ય	સત્યશ્રી
૯.	આદ્વાસી વિકાસ સંસ્થાના પ્રતિનિધિ	સત્યશ્રી
૧૦.	સામાજિક વિકાસ સંસ્થાના પ્રતિનિધિ	સત્યશ્રી
૧૧.	લઘુમતિ સંસ્થાના પ્રતિનિધિ	સત્યશ્રી

૧૨.	સ્ત્રી અને બાળ વિકાસ સંસ્થાના પ્રતિનિધિ	સત્યશ્રી
૧૩.	એક. બી.આર.સી. કો-ઓર્ડિનેટર.	સત્યશ્રી
૧૪.	એક સી.આર.સી. કો-ઓર્ડિનેટર.	સત્યશ્રી
૧૫.	એક આચાર્ય, બી.એડ, અથવા ડી. એડ કોલેજ	સત્યશ્રી
૧૬.	આચાર્ય, આઈ.એ.એસ.ઇ કોલેજ	સત્યશ્રી
૧૭.	આચાર્ય સી.ટી.ઇ. કોલેજ	સત્યશ્રી
૧૮.	જી.સી.ઇ.આર.ટીમાંથી એક પ્રતિનિધિ	સત્યશ્રી
૧૯.	એક એન.જી.ઓ કે જે શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત હોય તેના પ્રતિનિધિ	સત્યશ્રી
૨૦.	બે વિદ્યાર્થી, પીએસટીઇ(એક સીનીયર અને એક જુનીયર)	સત્યશ્રી

સંકલનની બેઠક સમિતિમાં નીચે જણાવ્યા પ્રમાણેના હોદ્દેદારો હોય છે.

૧.	પ્રાચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ અને તાલીમ ભવન	અધ્યક્ષશ્રી
૨.	જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરશ્રી	સત્યશ્રી
૩.	કેળવણી નિરીક્ષકક્ષી	સત્યશ્રી
૪.	જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ	સત્યશ્રી
૫.	ઉસ્ટ્ર્રીક પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરશ્રી (ડીપીઇપી જિલ્લો)	સત્યશ્રી
૬.	સીનીયર લેક્ચર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન	સત્યશ્રી સચિવ

કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ-૨૦૧૩ અન્વયેની આંતર ફરિયાદ નિવારણ સમિતિ આંતરિક સમિતિના

સત્યો :

૧. શ્રીમતી આર. આર. રાજ
૨. શ્રીમતી કે. એસ. વ્યાસ

મુદ્રા નં. ૮

કચેરીના અધિકારી/કર્મચારીઓની માહિતી.

ક્રમ	કર્મચારી/અધિકારીનું નામ	હોદ્દો	ટેલીફોન નંબર	
			મોબાઈલ	ઘર
૧	શ્રી એસ. બી. બાવા	પ્રાચાર્યશ્રી	૯૪૨૭૦૫૦૮૨૧	-
૨	શ્રીમતી આર. એમ. રાજ	સિનિયર લેક્ચરર	૯૮૨૪૦૩૬૮૪૬	-
૩	શ્રી એન. જી. સોલંકી	સિનિયર લેક્ચરર	૯૪૨૭૦૧૨૦૫૬	
૪	શ્રી આર. એ. રાવલ	સિનિયર લેક્ચરર	૯૪૨૮૬૫૨૭૫૧	-
૫	શ્રી જે. કે. દેસાઈ	સિનિયર લેક્ચરર	૯૮૮૮૪૭૨૫૮૪	-
૬	ડૉ. શ્રી ડી. વાય. તિવારી	સિનિયર લેક્ચરર	૯૪૨૮૧૨૩૧૦૧	-
૭	શ્રીમતી કે. એસ. વ્યાસ	લેક્ચરર	૯૪૨૮૧૨૪૮૭૧	-
૮	શ્રીમતી એલ. જી. ઉપાધ્યાય	લેક્ચરર	૯૪૨૬૮૮૫૪૩૪	-
૯	શ્રીમતી એસ. વી. કશ્યપ	લેક્ચરર	૯૮૭૬૦૮૮૮૮૮	-
૧૦	શ્રી બી. પી. પરમાર	લેક્ચરર	૯૯૨૪૨૧૮૩૮૨	-
૧૧	શ્રી ડી. જે. ચાવડા	લેક્ચરર	૯૯૦૮૫૪૦૨૨૮	-
૧૨	શ્રી જે. એલ. પટેલ	લેક્ચરર	૯૯૦૮૧૫૪૩૩૩	-
૧૩	શ્રી આઈ.ડી. વોરા	લેક્ચરર	૯૪૨૭૩૦૫૭૮૫	-
૧૪	શ્રી એન. સી. પટેલ	લેક્ચરર	૯૬૬૨૦૧૫૮૮૪	-
૧૫	શ્રી કે. ડી. પટેલ	ટેકનીશિયન	૯૮૭૬૭૩૮૧૮૮	-
૧૬	શ્રી જે.કે.વડુ	ઓડિટર ગ્રુપ-૧	૯૧૪૧૪૮૮૧૪૨	-
૧૭	શ્રી આઈ એન જાલા	મુખ્ય કારકુન	૭૮૮૦૫૫૬૦૦૮	-
૧૮	શ્રી બી. કે. લેઉઆ	સિ. કારકુન	૯૩૮૩૨૧૩૩૪૭	-
૧૯	શ્રીમતી એસ. ડી. પાઠક	સિ. કારકુન	૯૭૭૬૦૬૮૬૮૬	-
૨૦	શ્રીમતી પિંકાબેન એચ. પટેલ	સિ. કારકુન	૯૫૩૭૮૮૫૬૮૧	-
૨૧	શ્રીમતી કે. એ. હીરપરા	જુનિયર કારકુન	૯૯૮૮૮૮૦૬૪૮	-
૨૨	શ્રી જી. આઈ. જોખી	જુનિયર કારકુન	૯૮૮૮૭૮૧૮૮૧	-

મુદ્રા નં. ૧૦

કચેરીના અધિકારીશ્રી તેમના કર્મચારીઓના વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ
સહિત તેમના અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક મળતર.

ક્રમ	કર્મચારી/અધિકારીનું નામ	હોદ્દો	પગાર ધોરણ રૂ.	શાખાનું નામ
૧	શ્રી એસ. બી. બાવા	પ્રાચાર્યશ્રી	૧૫૬૦૦-૩૮૯૦૦	ADM
૨	શ્રીમતી આર. એમ. રાજ	સિનિયર લેક્ચરર	૮૩૦૦-૩૪૮૦૦	PSTE
૩	શ્રી એન. જી. સોલંકી	સિનિયર લેક્ચરર	૮૩૦૦-૩૪૮૦૦	WE
૪	શ્રી આર. એ. રાવલ	સિનિયર લેક્ચરર	૮૩૦૦-૩૪૮૦૦	CMDE
૫	શ્રી જે. કે. દેસાઈ	સિનિયર લેક્ચરર	૮૩૦૦-૩૪૮૦૦	IFIC
૬	ડૉ.શ્રી ડી. વાય. તિવારી	સિનિયર લેક્ચરર	૮૩૦૦-૩૪૮૦૦	ET
૭	શ્રીમતી કે. એસ. વ્યાસ	લેક્ચરર	૮૩૦૦-૩૪૮૦૦	PSTE
૮	શ્રીમતી એલ. જી. ઉપાધ્યાય	લેક્ચરર	૮૩૦૦-૩૪૮૦૦	PSTE
૯	શ્રીમતી એસ. વી. કશ્યપ	લેક્ચરર	૮૩૦૦-૩૪૮૦૦	PSTE
૧૦	શ્રી બી. પી. પરમાર	લેક્ચરર	૮૩૦૦-૩૪૮૦૦	PSTE
૧૧	શ્રી ડી. જે. ચાવડા	લેક્ચરર	૮૩૦૦-૩૪૮૦૦	PSTE
૧૨	શ્રી જે. એલ. પટેલ	લેક્ચરર	૮૩૦૦-૩૪૮૦૦	PSTE
૧૩	શ્રી આઈ.ડી. વોરા	લેક્ચરર	૮૩૦૦-૩૪૮૦૦	CMDE
૧૪	શ્રી એન. સી. પટેલ	લેક્ચરર	૮૩૦૦-૩૪૮૦૦	IFIC
૧૫	શ્રી કે. ડી. પટેલ	ટેકનીશિયન	૮૩૦૦-૩૪૮૦૦	ET
૧૬	શ્રી જે.કે.વડુ	ઓડિટર ગ્રુપ-૧	૮૩૦૦-૩૪૮૦૦	ADM
૧૭	શ્રી આઈ એન ઝાલા	મુખ્ય કારકુન	૮૩૦૦-૩૪૮૦૦	હિસાબી
૧૮	શ્રી બી. કે. લેઉઆ	સિ. કારકુન	૫૨૦૦-૨૦૨૦૦	હિસાબી
૧૯	શ્રીમતિ એસ. ડી. પાર્ક	સિ. કારકુન	૫૨૦૦-૨૦૨૦૦	મહેકમ
૨૦	શ્રીમતી પિંકાબેન એચ. પટેલ	સિ. કારકુન	૫૨૦૦-૨૦૨૦૦	હિસાબી
૨૧	શ્રી જે. આઇ. જોખી	જુનિયર કારકુન	૫૨૦૦-૨૦૨૦૦	PSTE
૨૨	શ્રીમતી કે. એ. હીરપરા	જુનિયર કારકુન	ફિક્સ ૧૮૮૫૦	રજીસ્ટ્રી શાખા

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કચેરીના મંજુર મહેકમના સંવર્ગવાર પગાર ધોરણ

ક્રમ	સંવર્ગનું નામ	સંવર્ગ	પગાર ધોરણ
૧	પ્રાચાર્ય	૧	૧૫૬૦૦-૩૮૧૦૦
૨	સિનીયર લેક્ચરર	૩	૮૩૦૦-૩૪૮૦૦
૩	જનીયર લેક્ચરર	૩	૮૩૦૦-૩૪૮૦૦
૪	ટેકનીશીયન	૩	૫૨૦૦-૨૦૨૦૦
૫	લાયબ્રેરીયન	૩	૫૨૦૦-૨૦૨૦૦
૬	સિનીયર કલાર્ક (આંકડા)	૩	૫૨૦૦-૨૦૨૦૦
૭	કોમ્પ્યુટર ઓપરેટર	૩	૫૨૦૦-૨૦૨૦૦
૮	ઓફિસ સુપ્રિન્ટેન્ટ (ઓડીટર ગ્રુપ-૧)	૩	૮૩૦૦-૩૪૮૦૦
૯	મુખ્ય કારકુન(એકાઉન્ટ)	૩	૮૩૦૦-૩૪૮૦૦
૧૦	મુખ્ય કારકુન(મહેકમ)	૩	૮૩૦૦-૩૪૮૦૦
૧૧	સિનીયર કલાર્ક	૩	૫૨૦૦-૨૦૨૦૦
૧૨	જનીયર કલાર્ક	૩	૫૨૦૦-૨૦૨૦૦
૧૩	રેકટર	૩	૫૨૦૦-૨૦૨૦૦
૧૪	પટાવાળા	૪	૪૪૪૦-૭૪૦૦
૧૫	વોચમેન	૪	૪૪૪૦-૭૪૦૦

મુદ્દા નં. ૧૧

**જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમદાવાદ શહેર યોજનાઓ, સૂચિત ખર્ચ અને ચૂકવેલા
નાણાં પરના દર્શાવતી તેની દરેક એજન્સીઓને ફાળવણી અંદાજ પત્ર (વર્ષ ૨૦૧૮-૧૯)**

(તા: ૩૧/૦૩/૨૦૨૦ ની સ્થિતિએ)

No.	Details	Received Rs.	Expenditure Rs.	% of Expenditure
1	CSS-TE - TRAINING	2000000	2000000	100%
2	EDN-12 TRAINING	700000	700000	100%
3	EDN -12 BALMELA	501000	501000	100%
4	EDN-12 ECOCLUB	602000	602000	100%
5	EDN -12 SCIENCE MATHS EXHIBITION	878200	878200	100%
6	EDN-12 CAMPUS DEVELOPMENT	50000	50000	100%
7	RESEARCH	588920	579500	98.4%
8	EDN-12 FITNESS CENTER	50000	50000	100%
9	EDN-16 L HEAD TEACHER	794000	744000	93.7%
10	KALA UTSAV	1521115	1504515	98.9%
11	PEC & HELP PROGRAM	64120	64120	100%
13	LOCAL MATERIAL & RESOURCE ROOM	116000	116000	100%
14	EDN-16 L YOG TRAINING	184000	184000	100%
15	EDN-16 L STATE LEVEL INNOVATION FAIR	2000000	2000000	95%
16	EDN-16 L INNOVATION FAIR	500000	500000	100%
17	CLASS ROOM FURNITURE & LIBRARY	250000	235286	94.11%
18	B.ED SPECIAL PROJECT	200000	200000	100%
19	NISTHA TRAINING	5726288	4388486	76.63%
20	B.ED SPECIAL GRANT	500000	500000	100%
	TOTAL	17225643	15797107	91.71%

મુદ્રા નં. ૧૨

કચેરીને ફાળવેલ રકમો સહિત સબસીડી કાર્યક્રમ અમલ બજવણીની રીત અને સેવા કાર્યક્રમો
લાભાર્થીઓની વિગતો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની કચેરી દ્વારા એવા ડોઇ આર્થિક
કાર્યક્રમો થતા નથી કે જેમાં લાભાર્થીઓ હોય. પ્રારંભિક શિક્ષણની ગુણવત્તા સુધારણા અર્થે
શિક્ષકોના તાલીમી કાર્યક્રમો યોજાતા હોય છે.

મુદ્રા નં. ૧૩

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અમદાવાદ શહેર દ્વારા અપાયેલ છૂટછાટો, પરવાનગીઓ
અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો.

આ મુદ્રો આ કચેરીને લાગુ પડતો નથી.

મુદ્રા નં. ૧૪

ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેની પાસેની માહિતીને લગતી વિગતો.

Website: www.dietahmdcity.org

મુદ્રા નં. ૧૫

જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તો તેવા વાંચનક્ષ અથવા તેના વાંચનાલયના
કામકાજના કલાકો સહિતની માહિતી માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની
વિગતો.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને પોતાના માટે સ્વતંત્ર વાંચનક્ષ હોય છે. જાહેર
ઉપયોગ માટે નથી.

કચેરીના કામકાજનો સમય: સવારે ૧૦-૩૦ થી ૧૮-૧૦ (સોમવાર થી શુક્રવાર)

સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ (૬૨ શનિવારે)

નોંધ: દરેક રવિવાર તથા જાહેર રજાઓમાં કચેરી બંધ રહે છે.

મુદ્રા નં. ૧૬

જાહેર માહિતી અધિકારીઓનું નામ: હોદ્દો અને બીજી વિગત.

૧. એપેલેન્ટ અધિકારીનું નામ : શ્રી એસ. બી. બાવા, પ્રાચ્યાર્થ

ટેલીફોન નં. ૦૭૯- ૨૯૭૯૬૭૫૫

૨. જાહેર માહિતી અધિકારી અધિકારીનું નામ: શ્રી જે.કે.વરુ

હોદ્દો: ઓડીટર શ્રુપ-૧

ટેલીફોન નં. ૦૭૯- ૨૯૭૯૬૭૫૫

૩. મદદ.જાહેર માહિતી અધિકારી અધિકારીનું નામ : શ્રી આઈ એન જાલા

હોદ્દો : હેડ કલાર્ક

ટેલીફોન નં. ૦૭૯- ૨૯૭૯૬૭૫૫

કચેરીનું સરનામું: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અમદાવાદ શહેર, ગોતા ઓગાંજ

રોડ, ગોતા, તા. અમદાવાદ જિ. અમદાવાદ

પીન. કોડ:-૩૮૦૦૬૦

મુદ્રા નં. ૧૭

ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી.